



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૯/૦૬/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૮૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૬ કેસ કરી, ૭૫ વ્યક્તિઓને ઝડપી, ૫૭૧ લીટર દેશી દારૂ, ૧૬૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧ બિયર ટીન, ૨ કાર, ૧ રિક્ષા, ૧ મોટર સાયકલ અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯૮૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૮૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી. ૧૦૭, ૧૦૯, ૧૧૦, ૧૫૧ મુજબ કુલ ૧૦૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૯૮૩/૧૯

**કાલુપુર:** સંજયકુમાર ચંદનમલ શાહ (રહે.ડો.ચંદ્રકાંત ગાંધી બંગ્લોઝ પોરવાલ સોસાયટીની ગલીમાં હિરાજૈન સોસાયટી રામનગર સાબરમતી) એ તા.૮/૬/૧૯ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૪/૦૧/૧૬ નારોજ કાલુપુર, આશીર્વાદ માર્કેટ, કપાસીયા બજાર, ખાતે આવેલ દુકાન નં.૨૦૬/એ “અંબીકા એન્ડ કુ” નામની સંજયકુમાર શાહની દુકાનેથી આરોપી (૧) દલાલ તારાચંદ સુથાર (રહે. માધવ ટેક્ષટાઇલ એજન્સી, ૬૪૦, ગલી ગાંડેશ્વર, ચાંદનીચોક, દિલ્હી) (૨) “ગૌતમ સ્વામી ટેક્ષટાઇલ” ના માલિક અનિલભાઈ ભગવાનસિંગ જૈન તથા (૩) “પ્રગ્યા ઇમ્પેક્ષ” ના માલિક સંયમ અનિલભાઈ જૈન (બન્ને રહે. ૯૩૧૮, સેક્ટર-૩, રાજેન્દ્રનગર, શાહીબાબાદ, ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશ) (૪) “વાહેગુરુ ફેબ્રીક્સ” ના માલિક શંભુ છાબડા તથા દિપકભાઈ છાબડા તથા રાજુભાઈ છાબડા (ત્રણેય રહે.૯/૭૭૪૬, કૈલાસનગર, દિલ્હી) એ ભેગા મળી શંદેના કાપડનો માલ કિંમત રૂપિયા ૭૦,૬૦,૬૫૮/- ખરીદી કરી નાણાં નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એચ.મહાર ચલાવે છે.

**વાસણા:** કાન્તાબહેન વા/ઓફ ભીખાજી ઠાકોર (ઉ.વ.૫૦) (રહે. કામદાર સોસાયટી બુટભવાની રોડ વેજલપુર) તા.૮/૬/૧૯ કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે બુટભવાની મંદિરથી શટલ ઓટોરિક્ષામાં બેસી જીવરાજ ચાર રસ્તા જતા હતા ત્યારે આરોપી રિક્ષામાં બેઠેલ બે પુરૂષોએ રિક્ષા ચાલકની મદદગારીથી કાન્તાબહેનને જીવરાજ ચાર રસ્તા ઉતરવાનું હતું છતાં આ પુરૂષોએ જીવરાજ પાર્ક ચાર રસ્તાથી આગળ મલાવ તળાવ તરફ સ્વસ્તીક જવેલ્સની દુકાન આગળ ઉતારી કાન્તાબહેન સાથે લોભામણી વાતો કરી વિશ્વાસમાં લઈ પૈસાનું પડીકું બતાવી કાન્તાબહેન પાસેની સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- કઢાવી લઈ છેતરપીંડી કરી નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ કાન્તાબહેન ઠાકોરે વાસણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ વુ.પો.સ.ઇ.શ્રી યુ.આર.ભટ્ટ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૯૮૪/૧૯

વાસણા: ભગવતીબહેન વા/ઓફ વિષ્ણુભાઈ સુથાર (ઉ.વ.૬૨) (રહે.સ્વામીનારાયણ પાર્ક -૨ ભાણગામ વાસણા) એ તા.૮/૬/૧૯ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૫/૧૯ થી તા.૧/૬/૧૯ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરની તિજોરીમાંથી સોનાની ચેન નંગ-૨ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-, સોનાની બુટીઓ બે કિંમત રૂપિયા ૩,૦૦૦/- સોનાની બુટી ડાયમંડ ઘાટની કિંમત રૂપિયા ૩,૦૦૦/-, એક સોનાની બુટી કડીવાળી કિંમત રૂપિયા ૩,૦૦૦/-, સોનાના પેડલ નંગ-૩ કિંમત રૂપિયા ૯૦૦૦/-, સોનાની વીટી કિંમત રૂપિયા ૩,૦૦૦/-, ચાંદીનો કંદોરો, લક્કી, સાંકળા બે જોડી મળી કિંમત રૂપિયા ૧૫,૦૦૦ /- મળી કુલ કિંમત રૂપિયા ૬૬,૦૦૦ /- મતાની અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.જે. જાડેજા ચલાવે છે.

ઉપરોક્ત ગુનાના કામે શકદાર આરોપી તરીકે ભગવતીબહેન સુથારની વહુ ડિમ્પલબહેન વા/ઓફ નીલેશભાઈ સુથાર દર્શાવેલ છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૯૮૫/૧૯

અમરાઈવાડી: કમળાબહેન વા/ઓ કાંતીભાઈ ઝાલા (ઉ.વ.૫૦) (રહે. જોગેન્દ્રસિંગની ચાલી રામનગર ભીલવાડા) તા.૮/૬/૧૯ બપોરના ૧૨/૦૦ વાગ્યાના સુમારે આશિમા કંપનીમાં પતરા ઉપર ચડી સફાઈ કરતા હતા ત્યારે પતરૂં તુટતા નીચે પડતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડૉશ્રીએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી સી.પી.રાવ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૮૬/૧૯

ઘાટલોડીયા: કાન્તીભાઈ છગનભાઈ પટેલ (ઉ.વ.૬૭) (રહે. રત્નદીપ ટાવર ઘાટલોડીયા) એ બિમારીથી કંટાળી તા.૮/૬/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એ.આર.ડાંગર ચલાવે છે.

શાહીબાગ: મયુરભાઈ અશોકભાઈ ગોહેલ (ઉ.વ.૨૯) (રહે. કે જે કડીયાની ચાલી બળીયા લીમડી ન્યુ સિવિલ રોડ શાહીબાગ) એ અગમ્ય કારણસર તા.૮/૬/૧૯ રાતના ૧૦/૨૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી અજીતસિંહ ચલાવે છે.

રખિયાલ: બળવંતભાઈ વિરાભાઈ વોરા (ઉ.વ.૬૦) (રહે. વિજયકામદાર સોસાયટી પ્રભાકર ટેનામેન્ટ પાછળ જી.ડી.હાઇસ્કૂલ રોડ સૈજપુર બોધા નરોડા) એ બિમારીથી કંટાળી તા.૮/૬/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે બાપુનગર જનરલ હોસ્પિટલના ચોથા કે પાંચમા માળેથી નીચે પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે રખિયાલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી બળદેવસિંહ રામસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.